

Registered Office: 924, 9 Floor, Fortune Tower,

Sayajigunj, Vadodara – 390020.

Email Id: mpagroindustries@gmail.com
Website: www.mpagroindustries.in.
Phone no.: +91 - 2653152583
CIN: L24123GJ1975SGC106981

Dt.: 15th November, 2024

To,

Corporate Filing,

Bombay Stock Exchange Limited,

P J Towers, Fort,

Mumbai

Scrip Code: 506543

SUB: Newspaper Publication of Unaudited Financial Results for the Quarter and half year ended on 30th September, 2024

Dear Sir/Madam,

Please find enclosed herewith a copy of newspaper publication, for extract of Unaudited Financial Results of the Company for the Quarter and half year ended on 30th September, 2024, published in Business Standard, English language newspaper (having Nationwide Circulation) and Vadodara Samachar (Regional language newspaper) at Vadodara, Gujarat on 15th November, 2024.

Kindly take the same in your record

Thanking you,

For M. P. Agro Industries Limited

CS Ishita Kapure Compliance Officer



Encl.: As Above

I SECURE CREDIT & CAPITAL SERVICES LIMITED Regd. Office: Old Nimta Road, Nandan Nagar, Belghoria, Kolkata-83, WB, India Admin. Office: 1st Floor, Hall No. 2, MR Icon, Next To Milestone Vasna Bhayli Road, Vadodara-391410, Gujarat Corp. Office: 1st Floor, City Castle Building East Fort, Thrissur-680005, Kerala E-mail: compliance@iccslimited.in

Website: www.orchidsecuritiesItd.com | Tel No.: +917574895589

SI. 30.09.2024 30.0	15.838 48.973			Year Ended 31.03.2024
	15.838 48.973	Unaudited		24 02 2024
I NO. Farticulars Unauditu Un			Unaudited	31.03.2024 Audited
1. Total Income from Operations 2. Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and /or Extraordinary Items#) (15	0.018) (0.630)	33.045 (193.280)	113.157 63.855	227.262 (9.051)
3. Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items#) (43.262)		(193.280)	63.855	(9.051)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items#) (43.248) (15		(193.256)	47.223	(9.101)
Total Comprehensive Income for the period (Comprising Profit/(loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)	(0.496)	(193.256)	47.223	(9.101)
	10.001 110.001 10.000 10.000	110.001 10.000	110.001 10.000	110.001 10.000 (27.500)
Operations) - (0.393) ((1.364) (0.005) (1.364) (0.005)	(1.757) (1.757)	0.429 0.429	(0.083) (0.083)

... The Statement of Unaudited Financial Result for the Quarter and half year ended 30th September 2024 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting neld on 14.11.2024.

. These Financial Results have been prepared in accordance with the Indian Accounting Standard (In-These Financian results have been prepared in accordance with the linear recomming standard (into AS) prescribed under Section 133 of the Company Act, 2013, read together with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (as amended) and requirement of Regulation 33 of the Securities and Exchange Board of India (SEBI) (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Figures of previous period have been re-grouped/re-arranged/re-classified where necessary t confirm to current period's classification.

4. The Statutory Auditors of the Company have carried out a "Limited Review Report" of the above result: as per Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulations, 2015. . No Investors complaint remains pending at the Quarter and Half Year Ended on 30th September, 2024 The Company had lent during the previous Financial Year, beyond the limit which was for the first time, hence it's impractical to assess the Financial implication of such an event to the Company and in such a scenario, no qualification, of the likely impact of its action on the Financials of the Company, was done. Which was the qualification in the Annual Report FY 2023-24.

Based on the guiding principles given in Ind AS-108 on 'Operating Segments', the Company' business activity fall within a single operating segment, namely Finance & related activities.

B. The above Financial Results are also available on the Company's website www.orchidsecuritiesItd.comand MSEI'S website www.mesi.in

For and behalf of Board I Secure Credit & Capital Services Limited

Sojan Vettukallel Avirachar Managing Director DIN-07593791 Place: Vadodara

BARODA EXTRUSION LTD. Regd. Office :- Survey No 65-66, Village Garadhiya, Jarod – Samalaya Road.

Ta. Savli, Dist. Vadodara Pin 391520. Web.: www.barodaextrusion.com CIN NO.: L27109GJ1991PLC016200 Email. works@barodaextrusion.com Statement of Standalone Unaudited Financial Results for the half year ended 30.09.2024 [See Regulation 47(1) (b) of the SEBI (LODR) Regulations, 2015] (Rs. In Lacs

				- (110: 111 = 400)
Sr.	Particulars	Current Quarter Ending	Quarter To	
No.		30-Sep-24	30-Sep-24	30-Sep-23
		(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total Income from Operations	3577.47	6883.66	3228.12
2	"Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	4.95	19.18	39.03
3	Net Profit for the period before tax (after Exceptional items and/or Extraordinary items#)	4.95	19.18	39.03
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	4.95	19.18	39.03
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	3.54	17.77	38.73
6	Equity Share Capital	1490.49	1490.49	1490.49
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year		-5415.09	
8	"Earnings Per Share (of Rs. 1/- each) (for continuing and discontinued operations) - 1) Basic: 2) Diluted:	0.00	0.01 0.01	0.03 0.03

Note:

Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (URL of the filings).

b) The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.

c) # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules whichever is applicable For Baroda Extrusion Limited

Date: Nov 14th, 2024 Place: Vadodara

Managing Director Din No. 0920021

Sd/-

Parasmal Kanugo

M. P. AGRO INDUSTRIES LIMITED

Reg. Office Add: 924, 9th Floor Fortune Tower, Sayajigunj, Vadodara - 390005 Website: www.mpagroindustries.in, Email: mpagroindustries@gmail.com, Phone No. +91-2653152583, CIN:L24123GJ1975SGC106981

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULT (STANDALONE) FOR THE QUARTER ENDED SEPTEMBER 30, 2024

	THE QUARTER ENDED SEPTE	MBER 30, 202	4	(Rs. Lakhs)
Sr. No.	Particulars	Quarter Ending 09.2024	Year to Date 04.2024 to 09.2024	Corresponding 3 Months Ended in previous year 09.2023
1	Total Income from operations	0.00	0.00	0.00
2	Other Income	10.10	20.19	8.69
3	Net profit (loss) for the period	1.43	3.98	-1.52
4	Net Profit Loss for the period before Tax	2.33	4.88	-1.52
5	Net Profit Loss for the period after Tax	1.72	3.60	-1.52
6	Total Comprehensive Income for the period	0.00	0.00	0.00
7	equity share capital	580.39	580.39	580.39
8	Reserves excluding revaluation reserve as shown in the Audited Balance Sheet of the previous year			
9	Earnings Per Share (of ₹10/- each)			
	Basic	0.030	0.060	-0.030
	Diluted	0.030	0.060	-0.030
	e: The above is an extract of the Audited Financial Results filed with the S			SEBI (LODR) Reg.

Place: Vadodara

Date: 14th November, 2024 Shamim Sheikh, Chairman L- HDFC BANK **HDFC Bank Ltd.**

By order of the Board

WAGHODIA RING ROAD, VADODARA

390019.

NOTICE

		Branch A	Address: I	HDFC Bank	Ltd., Trident,					
		Race Course	, Vadodar	a-390007. T€	el.: 079-64807999					
Amal and E Rules pay ti	Whereas the Authorised Officer/s of HDFC Bank Limited (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023), (HDFC) under Securitization And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of the said Notice/s, incidental expenses, costs, charges etctill the date of payment and / or realization.									
Sr. No.	Name Of Borrower (S) / Legal Heir(S) And Legal Representative(S)	Date Of Demand Notice	Date Of Possession Physical/ Symbolic	Description O Property Secured A	/ (ies) /					
	1	1	l i			.0001 (0)				
(a)	(b)	(c)	(d)	(e)	(f))				

with further interest as applicable, incidental expenses, costs, charges etc. incurred till the date of payment and/or realisation

31 July, 2022*

*with further interest as applicable, incidental expenses, costs, charges etc. incurred till the date of payment and/or realisation.

However, since the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove have failed to repay the amounts due, notice is hereby given to the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and to the public in general that the Authorized Officer/s of HDFC (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) have taken possession of the immovable property (les) / secured asset(s) described herein above in exercise of powers conferred on him/them under Section 13 (4) of the said Act read with Rule 8 of the said Rules on the dates mentioned above.

The borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and the public in general are hereby cautioned not to deal with the aforesaid Immovable Property (les) / Secured Asset(s) will be subject to the mortgage of HDFC Bank Ltd.

Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured asset/s.

Table to recent in the secured assessor, the control of the Panchama drawn and Inventory made are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Lega resentative(s) is / are requested to collect the respective copy from the undersigned on any working day during normal office hours.

Place : Vadodara

146523 - 643348380 and

Regd. Office: HDFC Bank Ltd. HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013. CIN: L65920MH1994PLC080618, Website: www.hdfcbank.com

SANRHEA

SANRHEA TECHNICAL TEXTILES LIMITED

CIN: L17110GJ1983PLC006309

Regd Office: Parshwanath Chambers, 2nd Floor, Nr. New RBI, Income Tax, Ahmedabad - 380 014. Phone: (02764) 225204 E-mail: sanrhea@gmail.com Website: www.sanrhea.com

Extract of Unaudited Financial Results for the Quarter/Half Year Ended on 30/09/2024

	(Rs. In Lakhs										
		Quarte	r Ended	Half Year Ended							
Sr. No.	Particulars	30.09.2024 Unaudited	30.09.2023 Unaudited	30.09.2024 Unaudited							
1	Total Income from operations	1981.56	1708.70	3674.11							
2	Net Profit / (Loss) for the period (before Tax,										
	Exceptional and/or Extraordinary items)	162.40	144.65	294.78							
3	Net Profit / (Loss) for the period before tax										
	(after Exceptional and/or Extraordinary items)	162.40	144.65	294.78							
4	Net Profit / (Loss) for the period after tax										
	(after Exceptional and/or Extraordinary items)	120.12	102.72	215.63							
5	Total Comprehensive Income for the period										
	[Comprising Profit / (Loss) for the period (after tax)										
	and Other Comprehensive Income (after tax)]	118.31	102.01	212.01							
6	Equity Share Capital	500.00	500.00	500.00							
7	Reserves (excluding Revaluation Reserve) as shown	-	-	-							
	in the Audited Balance Sheet of the previous year										
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing										
	and discontinued operations)										
	(a) Basic	2.40	2.06	4.31							
	(b) Diluted	2.40	2.06	4.31							

Notes:

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and on Company's website www.sanrhea.com For SANRHEA TECHNICAL TEXTILES LIMITED

Place: Ahmedabad Date: 13.11.2024

Sd/-**Tushar Patel (Managing Director)** DIN: 00031632

STATE BANK OF INDIA

Stressed Assets Recovery Branch: 2nd Floor, Samyak Status, Opp. D R Amin School, Diwalipura Main Road, Vadodara-390007, Phone No. 0265-2225292, E-mail: sbi.10059@sbi.co.ii

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES F-AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE ASSETS UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 READ WITH PROVISO TO RULE 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described Immovable Properties mortgaged/charged to the Secured Creditor, the **Physical Possession** of which has been taken by the Authorised Officer of State Bank of India, the Secured Creditor, will be sold on "As is Where is", As is What is" and Whatevel there is" basis for recovery of their dues to the secured creditor from under mentioned Borrower(s) / Guarantor(s).

Date & Time of E-Auction 18.12.2024 from 11:00 AM to 4:00 PM (with unlimited extensions clause of 10 minutes each

Shri Kaushikkumar Atulbhai Rathod (Borrower) Atulbhai Rathod (Borrower) Vadodara (Sr. No.	Borrower(s) & Guarantor(s) Details of Demand Notice with further Interest / expenses	Details of Properties	Reserve Price EMD Bid Increase Amount	Date & Time of Inspection / Contact Person
2. Sheeba Sajeev Vijayan (Co-Borrower) & Smt. Sheeba Sajeev Vijayan (Co-Borrower) Gorwa – G.H.B.)", Vadodara bearing Revenue Survey No. 626, 627 and 628, being City Survey No. 4316, Village Moje – GORWA, Tal. Vadodara of Registration Sub-District and District - Vadodara, State of Gujarat. 3. Shri Anish Narendra Shah (Borrower) & Smt. Nileemaben Anishbhai Shah (Guarantor) — Rs. 34,41,655.46 — Sheeme No 1, F. P. No. 344, being Flat No. B/301 (admeasuring Builtup area of 425 Sq. Ft and Super Builtup Area of 550 Sq. Ft) in Maruti Apartment, Shrinagar society, Dinesh Mill Road, Jetalpur, Vadodara (owned by Shri Anish Narendra Shah) (Borrower) Shrinagar society, Dinesh Mill Road, Jetalpur, Vadodara (owned by Shri Anish Narendra Shah) (Borrower) — Rs. 32,84,417.91 — 21.10.2023 — Rs. 32,67,611.26 — Rs. 32,6	1.	Atulbhai Rathod (Borrower) Rs. 30,04,831/-	All that Piece and Parcel of Immovable Property bearing Flat No. 302, Third Floor, Rachana Residency, Gotri, Vadodara, Registration District - Vadodara, Sub District - Vadodara, Mouje - Gotri, Survey No. 787/1 Paiki, Plot No. 8, 9, 10, 11, Shreenathkunj Housing Scheme, Plot No. 11/A, 12/B, Super Built Up Area 78.99 Sq. Mtr.,	Rs. 1,80,000/-	11:00 PM to 01:00 PM Karan Chawla
3. Shah (Borrower) & Smt. Nileemaben Anishbhai Shah (Guarantor) Rs. 34,41,655.46 Rs. 34,41,655.46 Shah (Borrower) Rs. 34,41,655.46 Scheme No 1, F. P. No. 344, being Flat No. B/301 (adm. construction area of 40.00 Sq. Mtrs) and Flat No. B/302 (admeasuring Builtup area of 425 Sq. Ft and Super Builtup Area of 550 Sq. Ft) in Maruti Apartment, Shrinagar society, Dinesh Mill Road. Jetalpur, Vadodara (owned by Shri Anish Narendra Shah) Shri Mohan Rajendran Naidu (Borrower) Rs. 32,84,417.91 Rs. 32,84,417.91 21.10.2023 Shri Mohan Rajendran Naidu (Borrower) Rs. 32,67,611.26 Rs. 32,67,611.26 Rs. 32,67,611.26 21.10.2023 All that piece and parcel of the Immovable Property in Apartment, Schrinagar society, Dinesh Mill Road. Jetalpur, Vadodara (owned by Shri Anish Narendra Shah) Property ID: SBIN200057131074 All that piece and parcel of Immovable Property bearing Flat No. C-301, 3''l Floor, Tower - C, 5''h Avenue, Manjalpur, Vadodara, Registration Dist. Vadodara, Sub Dist. Vadodara, Mouje - Manjalpur, RS No. 2, 250 Paiki 3, T. P. No. 29, F. P. No. 135, Super Built up Area 1020 Sq. Ft., Undivided Common Land Area 6.71 Sq. Mtr. Shri Mohan Rajendran Naidu (Borrower) Rs. 32,67,611.26 Rs. 30,00,000/- Rs. 30,000/- Rs. 30,000/-	2.	(Borrower) & Smt. Sheeba Sajeev Vijayan (Co-Borrower) Rs. 27,81,329.51	All that part and parcel of Immovable Property of Flat No. 12/156 on the First Floor, admeasuring 72.10 Sq. Mt. Built up area, in "PARISHRAM PARK (206 H.I.G.H. Gorwa – G.H.B.)", Vadodara bearing Revenue Survey No. 626, 627 and 628, being City Survey No. 4316, Village Moje - GORWA, Tal. Vadodara of Registration	Rs. 2,05,000/-	11:00 PM to 01:00 PM Karan Chawla
4. Naidu (Borrower) Rs. 32,84,417.91 Rs. 32,84,417.91 Plat No. C-301, 3 rd Floor, Tower - C, 5 th Avenue, Manjalpur, Vadodara, Registration Dist. Vadodara, Sub Dist. Vadodara, Mouje - Manjalpur, Rs No. 2, 250 Paiki 3, T. P. No. 29, F. P. No. 135, Super Built up Area 1020 Sq. Ft., Undivided Common Land Area 6.71 Sq. Mtr. Shri Mohan Rajendran Naidu (Borrower) Rs. 32,67,611.26 Rs. 32,67,611.26 Manjalpur, Vadodara, Registration Dist. Vadodara, Sub Dist. Vadodara, Mouje - Manjalpur, Rs No. 2, 250 Paiki 3, T. P. No. 29, F. P. No. 135, Super Built up Area 1020 Sq. Rs. 30,00,000/-Rs. 3,00,000/-Rs. 3,00	3.	Shah (Borrower) & Smt. Nileemaben Anishbhai Shah (Guarantor) Rs. 34,41,655.46	All that piece and parcel of the Immovable Property in Registration District-Vadodara, Sub District - Akota (Vibhag-3), Moje - Jetalpur situated at R.S. No. 477, T.P. Scheme No 1, F. P. No. 344, being Flat No. B/301 (adm. construction area of 40.00 Sq. Mtrs) and Flat No. B/302 (admeasuring Builtup area of 425 Sq. Ft and Super Builtup Area of 550 Sq. Ft) in Maruti Apartment, Shrinagar society, Dinesh Mill Road. Jetalpur, Vadodara	Rs. 2,50,000/-	02:00 PM to 04:00 PM Karan Chawla
5. Naidu (Borrower) Rs. 32,67,611.26 Rs. 32,67,611.26	4.	Naidu (Borrower) Rs. 32,84,417.91 	All that piece and parcel of Immovable Property bearing Flat No. C-301, 3 rd Floor, Tower - C, 5 th Avenue, Manjalpur, Vadodara, Registration Dist. Vadodara, Sub Dist. Vadodara, Mouje - Manjalpur, RS No. 2, 250 Paiki 3, T. P. No. 29, F. P. No. 135, Super Built up Area 1020 Sq.	Rs. 3,00,000/-	02:00 PM to 04:00 PM Karan Chawla
	5.	Naidu (Borrower) Rs. 32,67,611.26 	All that piece and parcel of Immovable Property bearing Flat No. C-302, 3 rd Floor, Tower - C, 5 th Avenue, Manjalpur, Vadodara, Registration Dist. Vadodara, Sub Dist. Vadodara, Mouje - Manjalpur, RS No. 2, 250 Paiki 3, T. P. No. 29, F. P. No. 135, Super Built up Area 1020 Sq.	Rs. 3,00,000/-	02:00 PM to 04:00 PM Karan Chawla

Date	a Time of E-Auction 19.12	2.2024 from 11:00 AM to 4:00 PM (with unlimited exte	ilisiolis ciause oi	TO minutes each
	Borrower(s) & Guarantor(s) Details of Demand Notice with further Interest / expenses	Details of Properties	Reserve Price EMD Bid Increase Amount	Date & Time of Inspection / Contact Person
1.	Shri Shrikantkumar Shanubhai Solanki (Borrower) 	Property ID: SBIN200066283304 All that part and parcel of Immovable Property located House No. D-263, Vraj Vihar Society, Tandalja, Vadodara, Registration District - Vadodara, Sub District - Vadodara, Mouje - Tandalja, RS No. 366, 378/1, 378/2, 379/1, 380, 380/1, Plot Area 94.00 Sq. mtr, Built up area 25.20 Sq. mtr, undivided common Plot & Land area of 40.91 Sq. mtr., Total area of 134.91 Sq. mtr (Property owned by Shrikantkumar Shanubhai Solanki).	Rs. 31,20,000/- Rs. 3,12,000/- Rs. 25,000/-	21.11.2024 11:00 AM to 01:00 PM R. P. Govindan 9909037276
2.	Smt. Meenakshi Atmanand Bhatnagar (Borrower) Shri Siddharth Atmanand Bhatnagar (Co-Borrower), Shri Atmanand Prakash Bhatnagar (Co-Borrower), M/s. Kala Training and Development Company (Proprietor Meenakshi Atmanand Bhatnagar, Guarantor: Siddharth Atmanand Bhatnagar) ————————————————————————————————————	Property ID: SBIN2000120532814 All that part and parcel of Immovable Property located at Plot No. B/226 (as per site) / Plot No. 1 (as per Sanctioned Plan) of the society known as 'Green Paradise' at Block No. 268 situated at Parujan bearing Revenue Survey No. Block No. 268/paiki, Plot No. 1 as per KJP, in Village - Parujan, Taluka - Jalalpore, District Navsari, admeasuring 182.94 Sq. mtrs along with undivided proportionate share in land. (Property owned by Smt. Meenakshi Atmanand Bhatnagar and Shri Siddharth Atmanand Bhatnagar)	Rs. 61,50,000/- Rs. 6,15,000/- Rs. 50,000/-	28.11.2024 2:00 PM to 04:00 PM

Encumbrances: To the best of knowledge and information of the Authorised Officer, there are no other encumbrances advised to the Bank. The intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of property ies put on auction and claims/rights/dues affecting the property, prior to submitting their bid. The e-Auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment or any representation of the bank. The properties are being sold with all the existing and future encumbrances whether known or unknown to the bank. The Authorised Officer/ Secured Creditor shall not be responsible in any way for any third party claims/rights/dues.

FDS/GST, wherever applicable, will have to be borne by the su Confirmation will be subject to consent of mortgagor/borrower if auction does not fetch more that the reserve price as per provision of SARFAESI rule 9(2).

The e-auction will be conducted through Bank's approved service provider M/s. SISL Infotech Pvt. Ltd. at their web portal https://www.ebkrav.in. The interested bidders shall ensure that they get themselves registered on the e-auction website and deposit earnest money in the virtual wallet created by service provider as per guidelines provided on https://www.ebkray.in The interested bidders who require assistance in creating Login ID & Password, uploading data, submitting Bid documents

Training / Demonstration, Terms & conditions on online Inter-se Bidding etc., may visit the website https://www.ebkray.in THIS NOTICE SHOULD ALSO BE CONSIDERED AS 30 DAYS NOTICE TO THE BORROWER/ GUARANTORS / MORTGAGORS LINDER BUILE 8 (6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) BUILE 2002 For detailed terms and conditions of the sale, please refer to the link provided in State Bank of India, the Secured Creditor's

Website https://sbi.co.in/web/sbi-in-the-news/auction-notices/sarfaesi-and-others. & https://ebkrav.in.

Authorized Officer, Place : Vadodara State Bank of India

्री बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

Ghod Dod Road Branch : Baroda Sun Complex, Opp. panjarpole, Ghod Dod Road, Surat - 395007 T.No.91 261 2294002/04/08 mail:- ghodod@bankofbaroda.co.in.

REF: Physical Possession Notice and inventory both dated 28.09.2024 of mortgage property in loan account of Mr. Kapilkumar Bhagvanjibhai Vasoya.

SUBJECT: Removal of household items which are taken Inventory on 28.09.2024 during the Physical Possession of Property bearing Fla No 1103 and 1203 on 11th and 12th Floor of Building No B/1-Ananta at site Building Known as ANANTA of "SHIVANTA PALACE constructed on the land bearing Sub Plot No B admeasuring 9381,00 sq., Mtrs of Final Plot No 21 admeasuring 16638,00 sq., Mtrs, Draft TF Scheme No.21 (Sarthana- Simada), Revenue Survey No 27/2, Block No 62 Part Admeasuring 25597.00 sq.mtrs of Village: Simada, Sul District: Puna, District: Surat.

Sir/ Madam

We refer to our possession notice along with inventory both dated 28.09.2024 wherein we have informed you that the Authorised office had received physical possession of captioned mortgaged property from the Court Commissioner in compliance of the Order no. CRMA No. 12570 dated 09.08.2024 of Hon'ble ACJM Court Surat under section 14 of SARFAESI Act on 28.09.2024. It is pertinent to mention here that we have initiated actions under SARFAESI Act to recover our legitimate dues against you and

We noticed that you are not extending cooperation in the prescribed procedure of law /SARFAESI Act. Your non-cooperative attitude conduct indicates that you are trying to hinder Bank's smooth recovery process with malicious intent but please note this will not be It is evident that Bank has informed you all progress and actions taken or to be taken under SARFAESI Act in your account and you are well

meticulously complied all quidelines under SARFAESI Act and directions of Honorable High Court of Guiarat and ACJM Court Surat.

aware about the process of taking possession of secured assets in compliance of the Order of Hon'ble Court and you were supposed to comply the Order of Hon'ble Court as law abiding citizen and should have personally provided the peaceful and vacant possession of the secured assets of Bank to Court commissioner/representative. It is evident that you maliciously purposefully did not take participation in the process of taking possession and not remove the uncharged eventory from the secured assets captioned property. It is evident that Bank officials have tried to connect with you and sought cooperation

for removing the uncharged inventory during taking the possession of captioned property on 28.09.2024 but we couldn't succeed. Therefore, no option left with Court Commissioner and Bank then the Court Commissioner has drawn an inventory of house hold articles lying at captioned property in presence of "Panches" and police personnel and took the videography of the incidents. The inventory and Panchnama is enclosed herewith for your ready reference. It is pertinent to mention or specify here that beside other house hold articles we have found locked digital locker/safe in captioned property

during taking possession and due to your non-cooperation we were not able to determine the goods available/lying in the locker and the Court Commissioner decided not to break open the closed locker. Further, we would like to further inform you that we are under process to put the captioned property in public e-auction for recovery of the legitimate dues of Bank under SARFAESI Act. Thereafter, we will deliver the vacant possession of secured assets i.e. captioned property to

successful bidder/ auction purchaser. Hence, you are advised to pay all legitimate dues of Bank immediately to avoid any unpleasant situation in this matter. Further, you are advised to visit the branch of undersigned and ensure to remove the inventory lying in captioned property immediately (not

more than 7 days from this letter). Please note if you do not turn up to remove this inventory within said 7 days period then it will be construed that you are maliciously as well as purposefully not removing the said inventory for frustrating our legitimate procedure of recovery Furthermore, we will have no other option but to take below mentioned firm actions/measures in the manner as may be deemed fit and prope by the Bank/Authorized officer against you at entire risk, cost and consequences to you. • We will break open the locked safe/locker with the local keymaker (as available in nearby location) and dispose off the inventory a

eemed fit and proper, without further communication to you and no claim will be entertained by Bank in future in this regard. • Further if you do not remove the inventory of household articles, we may keep the same in godown/other premises at your all cost. The

Bank will not be responsible for any damage or loss in this process. The Bank will have the right to recover the expenses incurred in the shifting of said inventory from you After lapse of said period of 7 days of this letter, Bank/AO will reserve the right to claim the expenses and rent of keeping the said inventory

• We will sell the inventory to the proposed auction purchaser on as is where is basis and sale consideration will be credited in your account with Bank after adjusting the expenses occurred in the said process.

Please provide your cooperation in this matter to avoid any unpleasant situation

ESSAR SHIPPING LIMITED

Statement of Standalone and Consolidated Unaudited Financial Results for the guarter and half year ended 30 September 2024

Regd. Office: EBTSL Premises, ER-2 Building (Admin Building) Salaya, 44 KM, P.O. Box No.7, Taluka Khambalia, Devbhumi Dwarka, Gujarat - 361305 Email: esl.secretarial@essar.co.in, • website: www.essar.com. • CIN: L61200GJ2010PLC060285 Head Office: Essar House, 11, Keshavrao Khadye Marg, Mahalaxmi, Mumbai 400 034

_											(₹ ir	rore ex	cept EPS
				Stand	dalone			Consolidated					
Sr.			uarter ende		Half Yea		Year ended	Quarter ended			,	r ended	Year ended
No.	, arabalara	30.09.2024	30.06.2024	30.09.2023	30.09.2024	30.09.2023	31.03.2024	30.09.2024	30.06.2024	30.09.2023	30.09.2024	30.09.2023	31.03.2024
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1.	Total income from operations	178.87	4.62	4.91	183.49	38.17	50.12	247.97	11.57	11.77	259.54	60.25	82.61
2.	Net Profit / (Loss) for the period / year (before tax, exceptional items and extraordinary items)	151.35	(26.35)	(0.20)	125.01	26.76	(19.90)	65.33	(24.59)	(33.59)	40.73	(15.58)	(118.08)
3.	Net Profit / (Loss) for the period / year before tax (after exceptional items and/or extraordinary items)	136.21	144.58	2.07	280.80	42.48	(71.18)	639.11	(34.53)	(36.74)	604.58	(10.61)	(105.14)
4.	Net Profit / (Loss) for the period /year after tax (after exceptional items and/or extraordinary items)	136.21	144.58	2.90	280.80	43.31	(70.35)	642.13	(34.53)	(35.91)	607.60	(9.78)	(104.31)
5.	Total comprehensive Profit / (Loss) for the period	136.24	144.48	2.51	280.73	43.00	(70.76)	642.16	(34.63)	(36.30)	607.53	(10.09)	(104.73)
6.	Paid-up equity share capital (face value of ₹10/- each)	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98
7.	Reserves (Excluding Revaluation Reserve)	-	- '	_	-	_	(1,881.22)	-	-	-	-	- 1	(3,014.29
8.	Securities Premium Account	3.36	3.36	3.36	3.36	3.36	3.36	3.36	66.96	66.66	3.36	66.66	66.90
9.	Net Worth	(1,393.23)	(1,529.47)	(1,560.48)	(1,393.23)	(1,560.48)	(1,674.24)	(2,408.38)	(3,004.06)	(2,695.05)	(2,408.38)	(2,695.05)	(2,807.31
10.	Paid up Debt Capital / Outstanding Debt	1,438.60	1,676.78	1,876.36	1,438.60	1,876.36	1,934.63	1,746.45	2,392.77	2,642.06	1,746.45	2,642.06	2,641.9
11.	Outstanding Redeemabe Preference Shares	-	- '	_	-	_	-	-	-	-	-	- 1	
12.	Debt equity ratio (times)	(1.03)	(1.10)	(1.20)	(1.03)	(1.20)	(1.16)	(0.73)	(0.80)	(0.98)	(0.73)	(0.98)	(0.94
13.	Earnings per share (of ₹10/- each) (EPS)		'										
	(a) Basic (in ₹)	*6.58	*6.99	*0.14	*13.57	*2.09	(3.4)	*31.02	*(1.67)	*(1.73)	*29.36	*(0.47)	*(5.04
	(b) Diluted (in ₹)	*6.58	*6.99	*0.14	*13.57	*2.09	(3.4)	*31.02	*(1.67)	*(1.73)	*29.36	*(0.47)	*(5.0
14.	Capital Redemption Reserve	-	- '	_	-	_	-	-	-	-	-	- 1	
15.	Debenture redemption reserve	-	- '	_	-	_	-	-	-	-	-	- 1	
16.	Debt service coverage ratio (times)	2.72	(0.00)	0.01	0.15	0.44	0.02	0.13	(0.01)	0.04	0.05	0.31	(0.00
. 17.	Interest service coverage ratio (times)	7.50	(0.21)	0.97	3.58	9.98	0.59	3.33	(0.31)	0.07	1.72	1.28	(0.0)

*Not annualised

Place : Mumbai

Date: 13 November, 2024

The above is an extract of the detailed format of Standalone & Consolidated Financial Result for the quarter and half year ended 30 September, 2024 filed with stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and consolidated audited Financial Results for the guarter and half year ended 30 September, 2024, are available on the website of the Company, www.essar.com and website of the Exchange (www.bseindia.com and www.nseindia.com)

For Essar Shipping Limited

Raichel Mathew Director

ESSAR

Date: 09.10.2024

Authorised Officer, Chief Manager, Bank of Baroda Ghod Dod Road Branch, Surat

અઝીમ પ્રેમજી ચુનિવર્સિટી બેંગલુરુ અને ભોપાલ કેમ્પસમાં પીજી અને ચૂજી અભ્યાસક્રમો માટે ઍરજીઓ આમંત્રિત કરી રહી છે

પ્રેરણ આપવાનો છે. પ્રેરણ આપવાનો છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટી તેના બે વર્ષના અનુસ્તાતક કાર્યક્રમો માટે અજીમ પ્રેમજી યુનિવર્સિટી તેના બે વર્ષના અનુસ્તાતક કાર્યક્રમો માટે અજીમ પ્રેમજી યુનિવર્સિટીમાં શિક્ષજી અમેઅમે પ્રોગ્રામમાં એમએ એજીક્ષ્રરાન, અમારા મૃષ્ય અભ્યાસક્રમાં શિક્ષજી એમએ પ્રેગ્રામમાં એમએ એજીક્ષ્રરાન, અમારા મૃષ્ય અભ્યાસક્રમાં શિક્ષજી એમએ પ્રેગ્રવસ્તામાં એમએ એજીક્ષ્રરાન, અમારા મૃષ્ય અભ્યાસક્રમાં શિક્ષજી એમએ એક્સ્વર્યક્રનનો સમાવેશ થાય છે. આ વર્ષો આઇલ્ડહું કે વિદ્યાર્થીઓને તેમના રસના ક્ષેત્રોને આગળ એજેક્ષ્રક્રનનો સમાવેશ થાય છે. આ વર્ષાઓનો ઉદ્યાર્થી વાર્ષા છે. અમે અંગ્રવસામાં આવી છે. આ કાર્યક્રમો એમએ અનુભવામાં ઉદ્યુ હી જાય છે. તેમને મંગ્રાવયામાં આવી છે. આ કાર્યક્રમો એમે એમ અનુભવામાં ઉદ્યુ હી જાય છે. તેમને મંગ્રવાયાં આવી છે. આ કાર્યક્રમો અપ્રેય છે. દિશ્લાર્થીઓને શિક્ષજી સ્તિ દિશસ, ભાષ આ કાર્યક્રમોનો ઉદ્યાર્થી વાર્યીઓને સ્ત્રિજી સ્ત્રામાં અને તેમનામાં શિવાયી અને પેસ્ત્રમાં વ્યાયાર્થીએ વાર્ષો છે. વિદ્યાર્થીઓને ક્ષ્મળા અને તેમનામાં શિવાયી અને પેસ્ત્રમાં અપ્રેયુર્જી કારલિકી શોષવા અને કે વર્કશોપ, સૌમિનાદ, ગેસ્ટ લેક્સર વર્ગરે તેમના અર્થપૂર્ણ કારલિકી શોષવા અને કે વર્કશોપ, સૌમિનાદ, ગેસ્ટ લેક્સર વર્ગરે તેમના અર્થપૂર્ણ કારલિકી શોષવા અને કે વર્કશોપ, સૌમિનાદ, ગેસ્ટ લેક્સર વર્ગરે લેક્સર વર્ગર વર્ગરે લેક્સર લેક્સર વર્ગર સ્ત્રે લેક્સર લેક્સર વર્ગર સ્ત્રે લેક્સર લેક્સર લ તેમને અર્થપૂર્ણ કારકિર્દી શોધવા અને શિક્ષણના માર્ગ પર આગળ વધવા માટે

પરિચય કરાવવામાં આવે છે.પ્રવેશ પ્રક્રિયાઃ વિદ્યાર્થીઓ અમારી યુનિવર્સિટીની વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. ડિસેમ્બર ૨૦૨૪માં યોજાનારી રાષ્ટ્રીય પેનેલાઇંગ્લે કુલાઈ પુરં પહેલા કર્યું હતું. કુલાઈ કુલાઈ માં કે સાથે કુલાઈ રાષ્ટ્રીય સત્તરની પ્રતેશ પરીક્ષા હતા પ્રતેશ મેળાવી સાંધાના વિદ્યાર્થીઓ જે ઇન્સેમ્બર ૧૦૦૩ જે સુધીમાં અરજી કરવી જોઈએ નાલાકીએ કાહાય વૃત્તિવર્સિટી વિચાયલાન માટે પ્રતિબદ ઉંચાર્થીઓને ત્રવૃત્તિ કુલાઈ કુલાઈ કુલાઈ કુલાઈ કુલાઈ કુલાઈ કુલાઈઓને ત્રવૃત્તિ કુલાઈઓને પ્રતુષ્ધ માટે (સાંધાર્થીઓને ત્રવૃત્તિ કુલાઈઓને કુલાઈકિની એપ ત્રવૃત્તિ કુલાઈઓને કુલાઈકિની એપ ત્રવૃત્તિ કુલાઈઓને કુલાઈકિની એપ ત્રકાર્થીઓને કુલાઈકિની એપ ત્રકાર્થીઓને કુલાઈકિની એપ ત્રકાર્થી માર્ચક્રિયાન અને પ્રતુષ્ધ કુલાઈએ માર્ચક્રિયાન અને પ્રતુષ્ધ કુલાઈઓને કુલાઈકિની એપ ત્રકાર્થી માર્ચક્રિયાન અને પ્રતુષ્ધ કુલાઈએ માર્ચક્રિયાન અને પ્રતુષ્ધ કુલાઈએ માર્ચક્રિયાન અને પ્રતુષ્ધ કુલાઈએ અને કુલાઈએ સાથ્યાર્થી સ્ત્રવૃત્તિ કુલાઈએ કુલાઈ કુલાઈ

ત્રાપુલા કરાયુપાતા અહિત તકે છે. સાથ જ જે યુવાઓના તા.૦૧.૧૦,૨૦૨૫ થી તા.૦૧.૧૦.૨૦૨૫ દરમિયાન ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેઓ ઍડવાન્સ ઍપ્લિકેશન કરી સંબંધિત ક્વાર્ટરમાં તેમનું નામ

નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ મતદારયાદીમાંથી નામ કમે કરાવવા કોર્મ બરી શકાશે. વધુમાં ખાસ ઝૂંબેશના દિવસો સિસાય તા. ૨૮, ૧૮, ૨૮ પ્ર સુધી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી, મતદાર મોષણી બહિરાદીન કચેરી તેમજ મામલતદાર કચેરી ખાસે રાખવામાં આવેલી મતદારયાદીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકાશે. સાથે જ જરૂર જભાઇ અસ્છ પણ રજૂ કરી શકાશે. ખાસ ઝૂંબેશના દિવસોએ મતદાન કેનો પર ઉપસ્થિત ભૂલ લેવલ આંધિક સર્વ હારા કરવામાં આવતી ક્રામગીરીની સમીશા કરી ચોંચ પે દિશાનિર્દેશ આપવા જિલ્લા ચૂંટલી તંત્રના અધિકારીશ્રીઓને સુખ્યનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત સુવનાઓ આપવામાં આવો છે. ઓ ઉપરીત મુખ્ય નિવાંચન અધિકારીથ્રી સહિત રાજ્યના ચૂંટલી તંત્રના ઉચ્ચ અધિકારીથ્રીઓ દ્વારા ભારતના ચૂંટલી પંચની મનદારપાદીને લગતી માર્ગદર્શિકા બનુસારની કાર્યપ્રભાવીનું યોગ્ય પાલન થાય તે સુનિચિત કરવા તમામ જિલ્લાના વિવિધ મતદાન મથકોની આકસ્મિક મુલાકત પણ લેવામાં આવશે.

જનજાતિચ ગોરવ દિવસની ઉજવણી નિમીત્તે વડાપ્રધાન'પી. એમ. જનમન અભિયાન'ના લાભાથીઓ સાથે કરશે

મતદારચાદીમાં નામ નોંધાવવાની તક, આગામી તા. ૧७,

૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ ચોજાશે ખાસ ઝુંબેશ દિવસ

● આમદાવાદ, તા. ૧૪ ગાળની જુના મહત્વાનું મુંત્રની ૧૫૦ની જુના જુનેની નિષ્કિત વડાપ્રધાન નરેત્વભાઈ મોદી દ્વારા બિહારના જુમુઈ ખાતેથી 'પ્રધાનમંત્રી' જુનજાતિ આદિવાસી ત્યાય મહા અભિયાન- પી.એમ. જુનમાને ના લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ કરશે. આ સાથે દરકાયા પાંચ તેને આખ જુનજાતિય ગ્રામ ઉત્કર્ય અભિયાન- નો શુભારંભ કરાવવામાં આવશે

જેના ભાગ૩પે રાજ્યકક્ષાની ઉજવણી જના ભાગપુર રાજપક્ષાના ઉજવભા આવતીકાલે તા. ૧૫મી નવેમ્બરે ડાંગના આહવા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્ડ પટેલની અધ્યક્ષતામાં આ ઈ-સંવાદ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત રાજપમાં મંત્રીશી, સાંસદતેમજ ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં 'જનજાતિય ગૌરવ દિવસ'ની ઉજવભી નિમિત્તે વિવિધ પ્રદેશો એવિક્સમાં અસ્ત્રી કાર્યક્રમો યોજવવામાં આવશે. જ્યારે કાયક્રમાં યાજપવાના આવતા. જ્વાર અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકાના શિયાળ ગામ ખાતે માનનીય મંત્રી મુળુભાઈ

બેરાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ આહવા ખાતે સવારે ૧૦ કલાકે યોજાનાર અતિથિ વિશેષ તરીકે આદિજાતિ વિકાસ

ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત

પ્રિતિકા એન્જિનિયરીંગ કમ્પોનન્ટ્સ લિમિટેડે હજ. ૫%ની વર્ષ-દર-વર્ષ EBITDA વુદ્ધિ સાથે મજબત નાણાકીય વર્ષ રપના બીજા ત્રિમાસિક પરિણામો આપ્યા

મોહાલી, ૧૧ □ મોહાલી, ૧૧ પ્રિતિકા એન્જીનીયરીંગ કોમ્પોનન્ટ્સ લિમિટેડ (NSE – PRITIKA), ભારતમાં ટ્રેક્ટર અને ઓટોમોટિવ સંક્ટર માટે પ્રિસિઝન મશીન્ડ કમ્પોનન્ટ્સના અગ્રણી ઉત્પાદકોમાંની એકને નાણાકીય વર્ષ ૨૫ના બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક બીજા તિમાસિક અને પ્રથમ અર્ધવાધિક અનઓદિક પહિસામીની જાહેરાત કીકો-આનંદ થઈ રહ્યો છે.નાશાકીય પ્રદર્શન પર, પ્રિતિકા એન્જિનિયસિંગ કમ્યોનન્ટ્સ નિયિટના મેનેજિંગ ડિકેટ્ટર શ્રી હત્યાને સિંહ નિબ્બરે જલાવ્યું, "અમને નાશાકીય વર્ષ ૨૫ના બીજા ત્રિમાસિક માને જન્મું તે દર્શનો છે, જેમાં આવકમાં વાર્ષિક ધોરાજે ૪૦૫૯૪નો નેશાયન ત્રમાં કોમ્પાર તે છે. 22.02 જમાં આવકમાં વાર્ષિક ધોરણ ૪૦.૫૯%ના નોંધપાત્ર વધારો મુખ્ય છે, જે ૩૨.૦૩ કરોડ સુધી પહોંચી છે. અમારો EBITDA ૭૪.૫૨%ની પ્રભાવશાળી વૃદ્ધિ સાથે વધ્યો તેમજ માર્જિન ૩૨૦ બેસિસ પોઈન્ટ વધીને ૧૬.૪૮% થઈ ગયું, જે કાર્યકારી કાર્યક્ષમતા પર અમારા સતત ધ્યાનને પ્રતિબ્રિબિત કરે અર્ધવાર્ષિક ટ્રેક્ટર ઉદ્યોગને બે આંકડામાં વૃદ્ધિ છે. ચોખ્ખો નકો પણ મજબૂત વૃદ્ધિ દર્શાવે પામવાની અપેક્ષા છે.

છે, જે ૭૮.૨૦% વધીને૧.૬૪ કરોડ થયો છે, જે અમારા વ્યવસાયની સ્થિરતા અને અમારા હિતઘરકો માટે અમારા દ્વારા બનાવવામાં આવી રહેલા મૂલ્યને દર્શાવે છે.અમારા નાણાકીય પ્રદર્શન ઉપરાંત, અમે તાજેતરમાં અમારી બજરની સ્થિતિને મજબૂત કરવાના હેતુથી થણી ગ્રહ્માત્મક પહેલી શરૂ કરી છો. ઉત્પાદનની પ્રાથમ અને છે. ત્યાદનની ખુલતા વધારવા અને આપા પદચિલને વિસ્તારવા માટેની અમારી પ્રતિબદના પહેલા છે. અમે અમારી ગ્રહ્માત્મક પરિલામો આપી રહી છે. અમે અમારી ગ્રહ્માત્મક પ્રાથમિકતાઓ પર અમલ કરવાનું જાળવી આખતા હોવાથી અમે આમારી શર્યારા એ માટે ટકાઉ વૃદ્ધિ અને લાંભા ગાળાના મૃલ્યને પહેંચાડવાની અમારી શમતામાં વિશાસ વર્શનીએ છીએ મહિન્દ્રના એન્ડ મહિન્દ્રા હિલિકેટ, જે છે. તિકા એન્જિનેપરિંગના સૌથી મોટા સાકકોમાંથીએ છે, તેલી તેની નાલાકીય વર્ષ ૨૫ના બીજા ત્રિમાસિક પ્રેઝ-ટેશનમાં ઉલ્લેખ કરો છે કે નાલાકીય વર્ષ ૨૫ના પ્રથમ પંચારી કરે છે. હોંગને એ આક્રેડિયા વર્ષ ૨૫ના પ્રથમ પંચારી કરે છે. હોંગને એ આક્રેડિયા વર્ષ ૨૫ના પ્રથમ પંચારી કરે છે. હોંગને એ આક્રેડિયા વર્ષ ૨૫ના પ્રથમ પંચારી કરે છે. હોંગને એ આક્રેડિયા વર્ષ ૧૫ પ્રથમ પંચારી કરે છે. હોંગને એ આક્રેડિયા વર્ષ દેશો હોંગને આક્રેડિયા વર્ષ દેશાના વર્ષ કર્યા હોંગને છે. અમારી બજારની સ્થિતિને મજબત કરવાના

લેક્સેસ ઇન્ડિયાએ ડિજિટેક ફ્રન્ટ રનર ઓફ ધ ચર ફિક્કી કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ એવોર્ડ ૨૦૨૪ જીત્યો

મુંલાઇ, ૩૦ લેક્સેસ ઈન્ડિયાએ રસાયણ ક્ષેત્રમાં ડિજિટેક કેન્ટ રનર ઓક ધ યર શ્રેણી માટે ફિક્કી ક્રેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ૨૦૨૪ જીત્યો છે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર સરકારના રસાયણ અને ખાતર મગાલવના કેમિકલ્સ અને પોડુંકિમિકલ લિગાગના સેકેટરી શ્રીમતી નિવેદિતા શુક્લા વર્મા અને ક્ષેત્રના અન્ય હિસ્સાધારકોની હાજરીમાં લેફ્સેસને આ એવોર્ડ અપાયો હતો. લેફ્સેસ ઈન્ડિયાના વાઈસ વેસ્મેન અને મેનેજિંગ ડાયરેક્ટર અને હોલટાઈમ ડાયરેક્ટર તથા પીટીએસઈના હેડ બાલારામ ખોતે ૧૭મી ઓક્ટોબર, ૨૦૨૪ના

સંસ્થાની કટિબહતાનું સન્માન કરે છે. પ્રક્રિયા સુધારક્ષા, એસેટ વિશ્વસનીયતા, સુરક્ષા, સશ્વમતા અને ખર્ચ બચન બહેતર બનાવતી અમારી શ્વમતા અને સાધનો પર ભાર આપે છે. અમારી વેલ્યુ ચેઈનમાં ડિજિટલ સાંલ્યુગન્સની વ્યૂહાત્મક અમલબજીવલી છે. અમે સંચાલન વ્યુક્ષાના ક અને વાખ ત્યાલા વકા અને ત્યાલા કેલ્કું કરતા કે અનુ વૃદ્ધિ પ્રેરિક કરવાનું ચાલુ કોમર્સ એક કેલ્કિટ્સન એક ઈન્ડિયન ચેમ્બર્સ એક કોમર્સ એન્ડ ઈન્ડરફરી (ફિન્ક્કી) હારા રસાયણ એને પેટ્રોફેમિકલ ઈહાંગના વિકાસમાં તેમના યોગદાન માટે કંપનીઓનું સન્યાન કરવા સમાર્રભની ઈન્ડિયા કેમ સિરીઝના ભાગરૂપે ફેમિકલ એન્ડ પેટ્રોફેમિકલ એનોર્ડસ સમાર્રભને આયોજન કર્યું હતું.આ સફળતા પર બોલતાં લેક્સેસ ઈન્ડિયાના વાઈસ ચેરમેન અને

મહેસાણામાં માર્ગ અકસ્માતમાં યુવકના મોત પછી અનેક વાહનોમાં આગચંપી

ડાયરનો અંકાર્ટ અકે ધુવાનનું પટનાસ્થળ થત નિપજો હુંતે, અસમાં ભાદ ત્યાં હાર્ટ ટો છું કે, ત્યાં હારણ લોકો હિંમા પટ બિની આવ્યા ઉદરેકાઈ ગયું અને બબાલ કરી હતી. જેમાં તો.ડાંડા અને આ ગયોપીને ઘટના સામે આવી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજો હતું. નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

સાવલી તાલુકામાં ખેડૂતો ને સિંચાઈ માટે કેનાલનું પાણી આવતું ન હોવાથી ખેડૂતોએ ડીઝલ પંપ વડે પાણી સિંચીને પોતાનો મહામૂલો પાક બચાવવા હવાતિયાં કરતા જોવા મેળી રહ્યા છે



■ સાવલી સાવલી તાલુકા માં ચાલુ સાલે ભારે મુશળધાર વરસાદ ના પગલે સૌથી વધુ આર્થિક નુક્કાન ભોગવવાનો ખેડૂતને વારો આવ્યો છે પોતે વાવેલો પાક ગણ ત્રણ વખત વરસાદમાં નષ્ટ થઈ જવાના પગલે ભારે વરસાદમાં નપ્ટે થઈ જવાના પણલે ભાર-આર્ષિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો વર્ષ ભેગા થવા માટે દેવું કરીને પણ નવા પાકની વાવણી કરી છે જેમાં મુખ્યત્વે પાસ વિદેવા તમાફ શાકભાજી થઈ ડાંગર જેવા મુખ્યત્વે પાસ કીંગ રીતે નવરાગીના દિવસીથી ઠંકીની શરૂઆત થઈ જીય છે પરંતુ ચાલુ સાલે આજ દિન સુધી દિવસમાં ભારે ગરમીનો અહેસાસ

થાય છે જેના કારણે ખેતરોમાંથી ભેજ ઉડી ગયો છે અને ખેડૂતોએ વાવેલો પાક બળવા લાગ્યો છે અને ખોતાનો મહામૂલો પાક બળી જવાથી બચાવા માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે તાલુકાની મોટાભાગની ખેતી કેનાલ આધારિત છે જ્યારે કેટલાક અપ્રી એમ્પ એ એપ્સે એક્સ્સ્ટ્રેસ્ટ્રેસ ખતી કનાલ આધારત છે જ્યાર કટલાક સુખી સંપ્રણ લોધ પોતાને ટ્યુબલેલ અને કુવા વરે સિંચાઈ કરીને પાકન બચાવી લે છે પરંતુ તેમાં પણ આવે હતાક શે ને જે લાઈટ મળતી હોવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે તેના કારણે તાલુકાના ખેતરો નદીનાળા અને ગટરોમાં બરાયેલા વરસાદી પાણી ડીઝલ પંપ (ડનવી મશીન) વડે ખેંચીને પોતાનો પાક બચાવવાની

થાય અને કનલામા પાણો છાડાય તતા માંગ કરી રહ્યા છે જાણા મળ્યા મુજબ ચોમાસામાં ભારે ના કારણે થયેલ પાક નું નુકશાન રાજ્ય સરકાર તરફથી હજુ સુધી પાક વળતર પણ ખતું નથી ત્યારે રાજ્યની ડબલ એન્જિનની સરકાર તાલુકાના ખેડૂતોની વ્યથાને સમજીને વહેલી તર્કે પાક નુસ્સાનીનું વળતર અને કેનલોમાં પાણી છોડાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે

નગરપાલિકાના વોર્ડ નંબર બે અને પાંચમાં માત્ર બેઠકોમાં ફેરફાર કરાચો છોટાઉદેપુર નગરપાલિકાનું વોર્ડવાર બેઠકોનું જાહેરનામું

ા <mark>છે છોટાઉદેપુર</mark> કરી શકે નહી વાસ્તવિક પ્રણાલી એવી ગુજરાતની અન્ય પાલિકામાં હાલની વાર્ડની સ્થિતિએ જે બેઠકો છે તે બેઠકે જ જાવેલ વાંધા ને સાંભળવામાં આવે વાર્ડની સ્થિતિએ જે બેઠકો છે તે બેઠકે જ જ્યોલ વાંધા ને સાંભળવામાં આવે પોક્રીની તમામ પાલિકાને વોર્ડ વાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિ આવતી હોય છે જેનો અહીંયા છેદ ઉડી જાતિ, સા. શે રીતે પછાત અને સામાન્ય નામદાર ગુજરાત હાઇકોર્ટ હાર ૨૦ ટકા સાહિતનું જાહેરમાના રાજ્ય ચુંદળી જાશિયેલ અનામત જાહેર કરવામાં આવ્યું પંચ હારા આજે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે પરંતુ છોટાઉદેપુર નગરપાલિકાને આ હતું આ જાહેરનામું આપ્યો પ્રસિદ્ધ ચુકાદા સંદર્ભ બેઠકો જર્તો બેઠકો લાળી નથી જયારે તરી કે બહાર પાડવામાં આવ્યું હોઈ હાલ કોઈ વાંધા સુચનો કોઈ નિયમનુસાર રજુ ૨૦ ટકા બલીપેચ અનામત નો પૂરો

પોકેટકોપ ઇ-પુષકોપ એપ્લીકેશનની મદદરી અમદવાદ શહેરના છેતારપીડીના પુનાનો મેદ ઉકેલી ફોપલીલ ગાડી રીકવર કરી આરોપીને રંગણ પોલીસ હારા પ્રદર્પો પાડવામાં આવ્યો હતો

છોટાઉદેપુરની રંગપુર પોલીસે અમદાવાદથી ચોરાચેલ ફોરવહીલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

ા કાર્યક્રેપુટ્ટ સંદિપસિંપ પોલીસ મહાનિરિશક વડોદરા વિભાગ, તથા ઈન્મિયાઝ રોખ પોલીસ અધિશક છોટાઈકપુટ તેમજ કોગ્ય સુર્યંત્રી નાબપ પોલીસ અધિશક છો... દી... હી... અને માર્ગદર્શન કોગ્ય સુર્યા અને માર્ગદર્શન કોગ્ય કોગ્ય સુર્યા અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બત્તા વાકત ચોલી તેમજ મીલ્કત સંબંધી ગુના પોકેટકોપ ઈ- ગુજકોપ એવીકેશનની મદદથી શોધી કાર્ક તમી જેના અના માર્ગદર્શ કાર્ય એમ. એક. હામોર પોલીસને સુર્યના કરવામાં આવી તમી જેના અના માર્ગદર્શ કાર્ય એમ. એક. હામોર પોલીસ ઇન્સ્પેક્ટર રેપપુર પો.સ. સ્ટકના માણસો સાથે રેપપુર પો.સ. સરક જતા હતા તે વખતે રજુવાંટ ગામ તરક બી. એન તે વખતે રજુવાંટ ગામ તરક જતા હતા તે વખતે રજુવાંટ ગામ તરક જતા હતા તે વખતે રજુવાંટ ગામ તરક જતા હતા તેને પોલીસ કર્યા આ ગાડી ઉભી રાખવા ઇશારો કરતા હોલ ભાગવા જતાં તેને પીલી કરી રોદી પોલીસ સ્ટેશન લાવી સદર વાલન ચાલકનું મામદામ પુછાને તેને પોતાનું માક સ્ટમ્સીંગ મામદા પુછાને તેને પોતાનું માક સ્ટમ્સીંગ સુરેસ્તાભાઈ જમરા(મીલાલા) ઉ.વ. ૩ ર હે. વાલ ઉજાડીયા જીપીયા કરીશાલા જી.અલીરાજપુર (એમ.પી)નો હોવાનું



જણાવેલ પકડાયેલ ઇસમ પાસે ગાડીની અમદાવાદ-ગુજરાતનો હોવાનું જણાય માલિકી અંગેના આધાર પુરાવો માંગતા તે આવેલ જેથી ક્રેટા ગાડીને પકડાયેલ ઇસમે જજ્ઞાવલ પકડાયલ ઇસમ પાસ ગાડીના માહિક અંગેના પાયાર પુરાવો માંગતા તે પોતાની પાસે કોઈ આધાર પુરાવો ન હોય અને ગલ્લા તલ્લા કરી ઉદાવ જવાબ આપતો હોય અને ગાડીનો કોઈ આધાર પુરાવો જજ્ કરેલ નહી જેથી કેટા ગાડીનો ચેસીસ નંબર. સ્છ⁶ઝ૮૧ ઉત્તર-૩૨૦૯૩૦ તથા એન્જીન નંબર ફુઝાઇ/સ્ટ૧૭૧૫૨ ની દિર ૧૨૦૦૦/ આવી તેને ગાડીના ક્રિ.રૂ.૧૨,૦૦,૦૦૦/- ગણી તેને ગાડીના એન્જીન તથા ચેસીસ નંબરને પોકેટકોપ

આવલ જથા કટા ગાડાન પકડાયલ ઇસમ ચોરી કે કોઇ છળકપટની મેળવેલ હોવાનો પાકો શક વહેમ પડતા વાહન માલીકના મોબાઇલ નંબર ઉપર કોન્ટેક્ટ કરતાં તેઓએ સદર ગાડી અંગે સાબરમતી રીવરફ્ટ ઇસ્ટ અમદાવાદ પોલીસ સ્ટેશનમા ગુ.ર.નં. ૧૧૧૯૧૦૫૦૨૪૦૦૮૧/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૧૬(૨),૩૧૮(૪) ાન ગાડા કર. ૧૧,૦૦,૦૦૦ - ગણા તન ગાડાના ભાગના એક. કલમ ૩૧ ૬ (૨), ૩૧ (૪) ફરી રોકી એન્જન નથા ચેસીસ નબને પોક્ટકોય પુરુખનો ગુનો ભનેલ વોચ સદર ગુનાના કોર દાચલકનું મોબાઇલથી સર્ચ કરતા સદર ગાડીનો પકડાયેલ કોરવડીલ ગાડીને બી.એન.એસ. કરમસીંગ સાચો રજી નંભર હત્ત -૩૮ મેન્ક-૦૮ ૧૨ નો એસ. કલમ, ૧૦૧ મુજબ કબજે કરી સદર ઉત્ત ૩૨ હોય જેના માલીક તરીકે શીવરાજસિંહ પકડાયેલ ઈસમ કરમસીંગ સુરેસ્તાભાઇ કઠીવાડા રાજેક્રસિંહ વાયેલા ૨સે.એબીકાનગર જમરા(ભીલાલા) ઉ.વ. ૩૨ સ્ટે.વાલ હોવાનું સોસાયટી સાજંદ,સોમનથ બસસ્ટેડ સામે તા.કઠીવાડા જી.અલીરાજપુર(એમ.પી)ે

કચ્છ રણોત્સવ ૨૦૨૪નો પ્રારંભઃ ૨૮ ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણશ

વષ રહ્યાત્સવના આવોજનમાં દકાઇ પ્રવાસન (સસ્ટેનેબલ દુરિઝમ) પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમ કે, પ્લાસ્ટિકનો લઘુત્તમ ઉપયોગ, સફેદ રહ્મમાં જવા માટે બાઈસિકલ

ડિસ્પોઝલની વ્યવસ્થા કરવામાં આવી છે. રહ્યોત્સવની સાથે-સાથે કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત પ્રવાસીઓ લઈ શકે તે માટે અલગ અલગ ટ્રાવેલ આઇટિનરી પણ ઉપલબ્ધ થશે.નોંધનીય છે કે આ વર્ષે પ્રવાસીઓ માટે સફેદ રહ્યમાં 3-સ્ટાર હોટલ/ પ્રવાસીઓ માટે સકંદ રણમાં ર-સ્ટાર લાંકળ દેસાર્ટ જેવી સુવિધાઓથી સક્ષ્ક ૪૦૦ જેટલા ટેન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે. આ વર્ષે ૧૧ નવેન્યવારી ટેન્ટ સિટીની શરૂઆત થઈ જો છે, જે ૨૮ કેબ્રુઆરી, ૨૦૨૫ સુધી સાલશે. ટેન્ટ સિટીમાં રહીને પ્રવાસીઓ મીઠાના સર્વેઠ રશનું અહૃત કુદરતી સીંદર્ય, લોક્સેસ્ટ્રિનિ તેમજ પરેપરાગત ભોજનનો આનંદ માશે છે. રશોસ્વાની મુલાકાત દરમ્થાન પ્રવાસીઓ માટે સંસ્થિતિ કાર્યક્રમો દરમ્યાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો દરયાન પ્રવાસાઓ માટે સાસ્કૃતિક કાયકમાં તેમજ વિવિધ એકને વર સાર્યું સે એક્ટિવેટી પણ યોજવામાં આવે છે. રણોત્સવ ૨૦૨૪-૨૫માં એડ્વેન્ચર એન (૨૦ અલગ-અલગ એડ્વેન્ચર પ્રવૃત્તિઓ જેવી કે પેરા મોટેરિંગ, એ.ટી.વી રાઈડ વગેરે), ચિલ્દુન એક્ટિવેટી વિષ કનાનોલેજ પાર્ક (૧૦ અલગ-અલગ પ્રવૃત્તિઓ જેમ કે, ન્યુટ્રિશનની સમજ આપતી ગેમ અને એક્ટિવિટી. વી. આર ગેમ આપતા ગમ અમે આક્ટાવટા, વા. આર ગમ ઝોન વગેરે)નું આયોજન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૨૩માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા

સફેદ રક્ષના વાંચ ટાવર ઉપર લાઈટ એન્ટ્ર સાઉન્ડ શોનું અનાવરાક કરવામાં આવ્યું હતું, જેથી મુલાકાતીઓ માટે નવું આકર્ષણ ઉમેરાયું છે. તો આ વર્ષ પ્રવાસન વિભાગ દારા યાંળાવીટા અનો પાર્થ પોરાલે ૪૪ રૂમ સાથેના રિસોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રવાસીઓનો સાચારી જોવા મળી હતા છે. રાસેન્દ્રની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષ પ્રવાસીઓની સાંખ્યાના વપારો થઈ દર વપ પ્રવાસાઓના સખ્યામાં વધારા થઇ રહ્યાં છે. વર્ષ ૨૦૨૩ - ૨૪ના ગુલોત્સવમાં ૮૫૨ વિદેશી સહિત ૭.૪૨ લાખ પ્રવાસીઓ આવ્યા હતા. ૨૦૨૩ - ૨૪ના રહ્યોત્સવમાં અંદાજિત ૨ લાખ લોકોએ કાકર સ્ટોલ અને ફુડ સ્ટોલની મુલાકાત લીધી હતી, જેના દ્વારા કાકટ સ્ટોલ ધારકોને અંદાજિત ૬.૧૫ કરોડ અને ફૂડ સ્ટોલ ધારકોને અંદાજિત ૧.૩૬ કરોડની આવક થઈ હતી. આ વર્ષે ૧. ૩૬ કરોડની આવક થઇ હતી. આ વર્ષ ક્રાક્ટ સ્ટોલ અને ફૂડ સ્ટોલની શરૂઆત ૧ ડિસેમ્બર ૨૦૨૪થી થશે. નોંધનીય છે કે ધોરડો ગામને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજુનો પણ એવોર્ડ એનાયત કરવામાં ાપલજના પણ અવાયત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન થકી છેલ્લાં ૨ દાયકામાં સરહદી જિલ્લો કચ્છ ડુરિઝમ ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચ્યો છે અને અહીંનો રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે.

ગામડાંની મિટ્ટીમાં ઉગતી સફળતા-સોલંકી પીનલબેનની અનોખી સફર . બહેનનું નામઃ-સોલંકી પીનલબેન પીનલબેન જ્યારે 'સત્ય સખી મંડળ' સાથે શિંકહ જોડાયા ત્યારે કદાચ એમને ખબર પણ . SHG ગ્રુપ નું નામઃ સત્ય નહોતી કે આ મંડળ એમના જીવનમાં મંડળ

સખીમંડળ 3. સરનામું: કોલંબા ૪. ગામ નું નામ કોલંબા ૫. તાલુકો: નસવાડી ૧. જીલ્લો:છીટાઉદેપુર નસવાડી તાલુકાના છેવાડાના ગામોમાં પણ સ્વાવલંબનની આશાઓ પાંગરવા લાગી છે. આ એવી જેએ કગાલ છે, પિશન ગોઝલ્યા ડેલા જોઇટ આ એવી જેએ કોલ્યા છે, પિશન મંગલમ' હેઠળ કાર્યરત સખી મંડળોની, જે મહિલાઓના જીવનમાં મોટી ફેરફાર લાવી મહલાઆના જીવનમાં મોટા ફરફાર લાવા રહી છે. કોલંબા ગામમાં વસતી સોલંકી પીનલબેન દિલીપસિંહની વાત કરવી છે. સામાન્ય ગ્રામીણ પરિવારમાંથી આવનાર

કે વર્કશોપ, સેમિનાર, ગેસ્ટ લેક્ચર વગેરે

અનોખી ઉર્જુનો સ્ત્રોત બની જશે. પીનાલબેન ના ઘર ની વાત કરિયે તો તેમના ઘર મો તેમના મમ્મી પપ્પા એને નાની બેહેન બધા સાથે રહેતા. તેમના પપ્પા ખેતી કામ કરતા ઘર ની પરસ્થિતિ એટલી સારી નહોતી જાતે તેમણે પ્રેજુએક્ત પાસ થયા. તેમને જીવન માં કંઈક કરવા ની ધગશ અને પુંટ નિશ્ચય હતા. પીનલબેન ઘરે થી વિશ્વણ નું કામ રહતા. સાથે તેમની બહેન ની શિક્ષણ ની જુવાબદારી આળાતા તેમને કુશળતા અને અભ્યાસ જોતા તેમની એક સખી દ્વારા સત્ય સખી મંડળ જોડવાની વાત

i સખી મંડળ સાથે જોડાયા બાદ ા પીનલબેનને RSETI (ગ્રામ્ય સ્વરોજગાર i તાલીમ સંસ્થા) હારા 'મ્ઝ સખી' તરીકે તાલીમ મળેલી. આ તાલીમ માત્ર જ્ઞાન પૂરું તાલામ મળલા. આ તાલામ માત્ર જ્ઞાન પૂરું પાડતી નહીં, પરંતુ નવા વિશ્વાના દરવાજા પણ ખોલતી. પીનલબેનને 'સેન્ટ્રલ બેંક એક ઇન્ડિયા'માં 'BC' તરીકે નોકરી મળી અને આજે તે દરરોજ ૧ લાખથી ૨ લાખ ટ્રીપ્યાનું લેવડ-દેવડ કરે છે. માસિક પ૦૦૦ થી ૬૦૦૦ રૂપિયાનું કમિશન મેળવતી પીનલબેન હવે માત્ર આર્લિક રીતે. સક્ષમ જ નહીં, પરંતુ સમાજમાં એક પ્રેરણા બની છે. "મારા જીવનમાં આર્થિક સ્તરથી લઈને જીવન ધોરણ સુધીના મોટા પરિવર્તન માટે સખી મંડળ અને 'મિશન મંગલમ'નો

એચડીએફસી બેંકની પરિવર્તન પહેલ ગુજરાતમાં ૫૮

બંક એચીએકસી બંક તેની સીએસઓર પહેલ ઈપીટવર્નન મારકતે ગુજરાતમાં અત્યાર સુધીમાં પ૮.પ૩ લાખ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી ચુકી છે. એચડીએકસી બેંકની પરિવર્તન પહેલ ગુજરાતમાં વર્ષ ૨૦૧૭થી ચાલી રહી છે. બેંકનો પરિવર્તન પ્રોગ્રામ ગ્રામ્યવિકાસ, શોજાવને પોત્રાનન શોગ્રામ ગ્રામ્યવિકાસ, શિક્ષણને પ્રોત્સાહન, કૌશલ્યવિકાસ

કચ્છ જિલ્લામાં એચઆરડીપી હેઠળ ૨૦૫ કચ્છ (જલ્લામાં અચેઆરડીયા હંઠળ ૨૦૫ ગામોને આવરી લીધાં છે. આ ઉપરાંત, તેણે ગુજરાતમાં તેના કોક્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હંઠળ અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, ડાંગ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહીસાગર, નવસારી, પંચમહાલ, રાજકોટ,

જુઇ સ્કા છે. ઇપારવતન હંઠળના પાંચ મુખ્ય ફોક્સ એરીયામાંથી પ્રાપ્યવિકાસ, શિક્ષણને પ્રોત્સાહન, કૌશલ્યની તાલીમ અને આજીવિકા વધારવીનો સૌથી વધારે પ્રભાવ પડ્યો છે, જેના કારણે અનુક્રમે ૩.૭૮ લાખ ખેડૂતો, ૩૧,૦૦૦ વિદ્યાર્થીઓ અને પગ્ર,૮૩૦ મહિલા ઉદ્યોગસાહસિકો અને પગ્ર,૮૩૦ મહિલા ઉદ્યોગસાહસિકો અને આજીવિકા વધારવી, આરોગ્ય સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાઓના લાભાન્તિત થઈ રહ્યાં છે. આ પાર્લેલની અને સ્વચ્છતા તથા નાણાકીય સાક્ષરતા ૪૧૭ ગામોને આવરી લઈ રાજ્યમાં સ્થાયી પહોંચ ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી ૧૭ અને સમાવેશન સહિતના પાંચ મુખ્ય વિકાસને આગળ વધાયોં છે.આ(સિવાયબેંક જિલ્લા સુધી છે.

છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય તથા આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬મીએ નસવાડી ખાતે સર્વરોંગ નિદાન કેમ્પ ચોજાશે

છોટાઉદેપુરઃ-રાજય સરકાર છેવાડાના માનવીના આરોગ્યની ચિંતા કરી છે. છેવાડાના માનવીના આરોગ્યને ધ્યાનમાં રાખીને

ઉપક્રમે સામુહીક આરોગ્ય કેન્દ્ર નસવાડી વાય કાર્ડ, સિકલસેલ તથા અન્ય રોગો ખાતે તા.૧૬ નવેમ્બરે સવારે ૦૯ માટે લાભાર્થીઓ કેમ્પનો લાભ લઈ વાગ્યાથી બપોરે ર વાગ્યા સુધી સર્વરોગ શકશે. આ કેમ્પમાં છોટાઉદંપુર જિલ્લા નિદાન કેમ્પ યોજવામાં આવશે. આ પંચાયત પ્રમુખ શ્રીમિત મલ્લાબને પટેલ, કેમ્પમાં આત્રયાસના ગામના લાભાર્થીઓ કારોબારી સમિતિના અધ્યક્ષ શર્મિલાબેન ાજુપ સરકાર છેવાડાના માનવીના ખાતે તા.૧ જ નચવાડી વાય કાર્ડ, સિકલસેલ તથા અન્ય રોગો આરોગની સિંતા કરી છે. છેવાડાના ખાતે તા.૧ જ નચેમ્બરે સવારે ૦૯ માટે લાભાર્થીઓ કેમ્પનો લાભ લઈ આરોગની સિંતા કરી છે. છેવાડાના માનવીના આરોગને પ્યાનમાં રાખીને નિર્દાલ કર્યા હોય કર્યા કર્યા હોય હોય હોય કર્યા હોય કર

મૈરિંગો CIMS હોસ્પિટલ દ્વારા મેદરવીતા અને મેટાબોલિક ડિસઓર્ડર સામે લડત

● અમદાવાદ મૈરિંગો CIMS હોસ્પિટલ દારા મેદસ્વીતા, ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડર જેવા રોગો ધરાવતી વ્યક્તિઓ માટે વિશેષ સારવાર અને સંભાળ પરી પાડવા માટે સમર્પિત એક અદ્યતન સવિધા

ટાન કારા માળકરાન આપવામાં આવે છે, અને દરેક દર્દીની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ તેઓને વ્યાપક અને વ્યક્તિગત સારવાર યોજનાઓ ઓફર કરવામાં આવે

આપવા માટે અત્યાધૃતિક આપ્ને સિટી એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું કેન્દ્ર ગુજરાતમાં મેદસીતાના ગંભીર સ્વાસ્થ્ય છે. આ સેન્ટરના ડોક્ટરોની ટીમમાં ડો. વિવેક મેટિંગ CIMS હોસ્પિટલ દારા સ્વત્રાતા, ડાયાબિટીસ અને મેટાબાલિક પ્રગતિ છે. મેદસીતા અને સુખાકારી માટેના ડો. ડી. (કેન્સસ્ટન્ટ એન્ડોકિનોલોજિસ્ટ), સ્ત્રાતિ છે. મેદસીતા, ડાયાબિટીસ અને મેટાબાલિક પ્રગતિ છે. મેદસીતા અને સુખાકારી માટેના ડો. રિકિન એમ શાહ (સ્કોપ-સર્ટિકાઇટ સ્થાપ્તિ જેવા તે) પારા પ્રાત્ર કર્યા પ્રાત્ર કર્યા અને સ્થાપ્તા પ્રાત્ર કર્યા પ્રાત્ર કર્યા અમેદ સ્થાપ્ત સ્થાપત સ્થાપ્ત સ્થાપ્ત સ્થાપત સ્થાપ્ત સ્થાપ્ત સ્થાપ્ત સ્થાપ્ત સ્થાપત સ્થાપ યાકશા (કન્સલ્ટન્ટ લગ્નારકાપક સંજંગ), અને કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ તરીકે ડો. ભાવેશ ઠક્કર, ડો. રાજીવકુમાર બંસલ અને ડો. નિલ્લેનો સમાવેશ થાય છે. આ મૃલ્ટિડિસિપ્લિનરી

M. P. AGRO INDUSTRIES LIMITED Year to Date 04.2024 to 09.2024 Months Ended in previous year 09.2023 580.39

શાસીરક અન મેટાબાેલિક બંને પાસાઓની સારવાર કરે છે, અને દરેક દર્દીના અન દરક દરાના સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ અને સહાયક અભિગમ ઓફર કરે છે.લોકોમાં વધી રહેલું, શહેરીકરણ, બેઠાડુ અને આળસુ જીવનશૈલી અને જીવનેશૈલી અને ઉચ્ચ-કેલ રીનો આહાર વધી રહ્યો છે અને તેના લીધે આવા રોગોમાં પણ વધારો થાય છે.

ટીમ સર્વગ્રાહી સંભાળ આપવા માટે સમર્પિત છે જે મેદસ્વીતાના

ગારીરિક શારીરિક

કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રાલયના રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલે ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના

ખાલારાત ખાત ૧૭ના આક્ટાપર, ૨૦૨૭માં લક્કલત ઇપ્લેચામાં વાઇસ ઘરનમ અન રોજ મુંબઈમાં આપોલિંત કાર્યક્રમાં સંસ્થા મેનોઇલ ડાયરેક્ટર નામિસ રોચ ચીવરીએ વતી હિજિટેક ક્રન્ટ રનર ઓફ ધ યર એવોર્ડ જણાવ્યું હતું કે, ''અમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.એવોર્ડ ક્લિટલાઈઝેશન પ્રત્યે પ્રાપ્ત થયો તે સન્માનજનક લાગે છે.

અમદાવાદ, તા. ૧૪ ઉત્તર ગુજરાતમાં આવેલા મહેસાણાના ભાન્ડુમાં એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની અડફેટે એક યુવાનનું ઘટનાસ્થળે મોત

અકસ્માતમાં યુવકની મોતથી ત્યાં હાજર લોકો રોધે ભરાયા હતાં અને ડમ્પર ચાલક સાથે બબાલ શરૂ કરી દીધી હતી. યુવકના મોત બાદ મામલો એટલો વધી ગયો કે, ત્યાં હાજર લોકો હિંસા પર ઉત્તરી આવ્યા